

## આવકવેરાની માહિતીસ્ત્રોતનો પત્ર જાન્યુઆરી 2022

તમારું આવકવેરા પત્રક કેવી રીતે દાખલ કરવું

શું તમને તમારું આવકવેરા પત્રક દાખલ કરવા માટે મદદની જરૂર છે? કેનેડા રેવેન્યુ એજન્સી (CRA) પાત્ર હોય તેવા લોકો માટે કમ્યુનિટી વૉલ્યુન્ટરી ઈન્કમ ટેક્સ પ્રોગ્રામ કરવા દ્વારા વિના મૂલ્યે ટેક્સ ક્લિનિક્સ પૂરી પાડે છે.

તમે તમારા ક્ષેત્રમાં CRAની વેબસાઈટ [Canada.ca/revenue-agency](https://Canada.ca/revenue-agency) પર વિના મૂલ્યે ટેક્સ ક્લિનિક્સની સૂચિને જોઈ શકો છો. ટોરોન્ટો શહેર પણ વિના મૂલ્યે ટેક્સ ક્લિનિક્સનું સમર્થન કરે છે; તમે વધુ માહિતી [toronto.ca](https://toronto.ca) પર અથવા 311 પર કૉલ કરવા દ્વારા જોઈ શકો છો.

તમે તમારા આવકવેરાને CRA દ્વારા માન્ય કરવામાં આવેલા નીચે આપેલા નેટફાઈલ સોફ્ટવેર્સ પૈકીનાં કોઈ પણ સોફ્ટવેરનો ઉપયોગ કરીને પણ દાખલ કરી શકો છો:

- ક્લાઉડ ટેક્સ
- H&R બ્લૉક (ઓનલાઈન)
- સિમ્પલ ટેક્સ
- ટર્બો ટેક્સ
- UFile ટેક્સ ક્રેડિટ્સ એન્ડ બેનિફિટ્સ

### ટેક્સ ક્રેડિટ્સ અને લાભ

દર વર્ષે તમારો આવકવેરો દાખલ કરવાથી, તમે વિવિધ ટેક્સ ક્રેડિટ્સ અને લાભ પ્રાપ્ત કરવા માટે પાત્ર બની શકો છો.

### ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ અને પરિવારો માટેનો આવકવેરો (LIFT)

• ઓછી આવક ધરાવતા વ્યક્તિઓ અને ઓછામાં ઓછું વેતન પ્રાપ્ત કરતા કામદારો માટે વ્યક્તિગત આવકવેરામાં \$850 સુધીની રાહત અને દંપતીઓ માટે \$1,700 સુધીની રાહત પૂરી પાડે છે

### ઑન્ટેરિયોમાં બાળકને લાભ

• ઓછીથી મધ્યમ આવક ધરાવતા પરિવારો માટે, પછી ભલે તેઓ કામ કરતા હોય કે ન કરતા હોય, દર વર્ષે પ્રતિ બાળક \$1,434ની મહત્તમ ચૂકવણી પૂરી પાડે છે

## ઑન્ટેરિયો ટ્રિલિયમનો લાભ (OTB)

- ઑન્ટેરિયો ટ્રિલિયમનો લાભ ઑન્ટેરિયો સેલ્સ ટેક્સ ક્રેડિટનો સમાવેશ કરે છે, જે ઓછી આવક ધરાવતા ઑન્ટેરિયોનાં નિવાસીઓ માટે તેઓ જે વેચાણવેરો ચૂકવે છે તેમાંથી રાહત મળે છે. પરિવારમાં પ્રત્યેક પુખ્ત વયની વ્યક્તિ અને બાળક માટે મહત્તમ વાર્ષિક ક્રેડિટ \$313 છે.
- ઑન્ટેરિયો ઊર્જા અને મિલકત-વેરો ક્રેડિટ પણ ઑન્ટેરિયો ટ્રિલિયમનાં લાભનો એક ભાગ છે. તેમ છતાં, મોટાભાગની TCHCની ઈમારતો નગરપાલિકા શિક્ષણ અને મિલકત-વેરામાંથી મુક્ત છે, તેમજ આ ઈમારતનાં ભાડૂતો મિલકત-વેરો ક્રેડિટ માટે પાત્ર બનતા નથી.
- TCHC ઈમારતોની એક સૂચિને, કે તે નગરપાલિકા શિક્ષણ અને મિલકત-વેરો ભરે છે, [torontohousing.ca/taxexempt](http://torontohousing.ca/taxexempt) માં ઓનલાઈન પોસ્ટ કરવામાં આવશે. તમે એ બાબતની પુષ્ટિ કરવા કે TCHC તમારી ઈમારતનો મિલકત-વેરો ભરે છે કે કેમ, TCHCનાં ગ્રાહક સંભાળ કેન્દ્રનો 416-981-5500 પર પણ સંપર્ક કરી શકો છો.

## કેનેડામાં બાળકોને લાભ (CCB)

- મહત્તમ વાર્ષિક લાભ 6 વર્ષથી નીચેનાં બાળક માટે \$6,765 પ્રતિ બાળક છે તેમજ 6થી 17 વર્ષની વયનાં બાળક માટે \$5,708 પ્રતિ બાળક છે.
- CCB બાળક વિકલાંગતાનાં લાભનો પણ સમાવેશ કરે છે. પ્રત્યેક પાત્ર બાળક માટેનો મહત્તમ લાભ પ્રતિ મહિને \$240 છે.

## કેનેડામાં કામદારોને લાભ (CWB)

- આ પરત મેળવવા પાત્ર કરવેરો ક્રેડિટ કામ કરવા માટે ઉપલબ્ધ કામદારો અથવા કામમાં રોકાયેલા કામદારો અને તેનાં પરિવારજનો માટે કરમાંથી રાહત પૂરી પાડે છે. મહત્તમ ચૂકવણી એકલા રહેતા વ્યક્તિઓ માટે \$1,381 છે તેમજ પરિવારો માટે \$2,379 છે.
- CWB વિકલાંગતા માટેની પરિપૂર્તિનો પણ સમાવેશ કરે છે. પાત્ર હોય તેવા એકલા રહેતા વ્યક્તિઓ અથવા પરિવારો માટેની મહત્તમ ચૂકવણી \$713 છે.

## GST/HST ક્રેડિટ

- આ કરમુક્ત ત્રિમાસિક ચૂકવણી એવી વ્યક્તિઓને અને ઓછી તેમજ માર્યાદિત આવક ધરાવતા પરિવારોને મદદરૂપ બને છે જેઓ જે GST અથવા HST ચૂકવે છે તેમાં પર્યાપ્ત વળતરનાં ભાગ તરીકે રજૂ કરી શકે છે
- મહત્તમ વાર્ષિક ક્રેડિટ જો તમે એકલા હો તો \$451 છે, જો તમે લગ્ન કરેલાં હોય અથવા મૈત્રીકરાર હેઠળ સહજીવન જીવી રહ્યા હો તો \$592 છે, તેમજ 19 વર્ષની નીચેનાં પ્રત્યેક બાળક માટે \$155 છે.

## ખાતરીપૂર્વકની આવક માટેની પરિપૂર્તિ (GIS)

- એવા વૃદ્ધાવસ્થા સુરક્ષા નિવૃત્તિ-વેતન પ્રાપ્તકર્તાઓ માટેનો એક માસિક બિન-કરપાત્ર લાભ જેઓ ઓછી આવક ધરાવે છે તેમજ કેનેડામાં નિવાસ કરે છે.
- મહત્તમ માસિક ચૂકવણીની રકમ \$919 છે.

## ઑન્ટેરિયોનાં વરિષ્ઠ લોકો માટે જાહેર પરિવહન કર ક્રેડિટ

- આ પરત મેળવવા પાત્ર કર ક્રેડિટ 65થી વધુ હોય તેવા વરિષ્ઠ લોકો માટે જાહેર પરિવહન પાછળ થતા ખર્ચાઓમાં મદદરૂપ બને છે.
- તમે પાત્ર કહી શકાય તેવા જાહેર પરિવહન પાછળ થતા ખર્ચાઓ માટે \$3,000 સુધીની રકમ તેમજ પ્રતિ વર્ષ \$450 સુધીની રકમ માટેનો દાવો કરી શકો છો.